



બી.આર.સી. – ગોંડલ

વર્ષ – ૨૦૨૫-૨૬

વેકેશન ગૃહકાર્ય

❖ પ્રેરક ❖

શ્રી એ. પી. વાણવી
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
રાજકોટ

શ્રી દિક્ષીતભાઈ એચ. પટેલ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને
જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડો.
રાજકોટ

❖ માર્ગદર્શક ❖

શ્રી વિપુલ એન. પાંચાણી
બી.આર.સી. કો. ઓર્ડો.
ગોંડલ

શ્રી સતીષભાઈ તેરૈયા
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
ગોંડલ

❖ સંકલન ❖

શ્રી પ્રશાંત પી. ગોહેલ
શ્રી મનીષાબેન એમ. ગજેરા
શ્રી હરેશભાઈ એસ. સરવૈયા
શ્રી પરાક્રમસિંહ એસ. જાડેજા,
શ્રી અલ્પેશભાઈ જી. વાછાણી,
શ્રી ચંદ્રકાંતભાઈ નિમાવત,
શ્રી વિપુલભાઈ વાણિયા,

બ્લોક IAS કો. ઓર્ડો.
સી.આર.સી. કો. ઓર્ડો.
સી.આર.સી. કો. ઓર્ડો.
આચાર્ય,
આસી. શિક્ષક,
આસી. શિક્ષક,
આસી. શિક્ષક,

બી.આર.સી. ગોંડલ
શાળા નં. – ૮, ગોંડલ
સુલતાનપુર કુમાર તાલુકા શાળા
રીબડા પ્રા. શાળા
અનીડા(ભા.) તાલુકા શાળા
નાના મહિકા પ્રા. શાળા
દેવડા પ્રા. શાળા



ધોરણ – 6 ગૃહકાર્ય

સુજ્ઞ વાલીશ્રી,

ઉનાળુ વેકેશન દરમિયાન એક જાગૃત વાલી તરીકે આ આપણી ફરજ છે.

આગામી ઉનાળુ વેકેશનમાં બાળકોને મોજ, મસ્તી, રમત-ગમતમાં લીન રહેવા દો. સાથે સાથે દરરોજ બે-ત્રણ કલાક વાંચન તથા અભ્યાસ કરાવવામાં આવે તો તેનું શિક્ષણ વેકેશનમાં પણ જીવંત રહે. વેકેશનમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ બાળકોને અવશ્ય કરવા દઈએ અને તેને પ્રોત્સાહન આપીએ...

અલગ નોટબુકમાં આ ગૃહકાર્ય લખવું.

➤ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર,

આગામી ઉનાળુ વેકેશન માટે દરરોજ વાંચન માટે આયોજનનું તમારું ટાઈમ ટેબલ બનાવો. જેમાં તમામ વિષયને આવરી લેવા.

હું સારો માણસ બનવા આટલું કરીશ.

- દરરોજ સવારે વહેલા ઉઠવાની ટેવ રાખવી અને માતા-પિતા અને વડીલોને વંદન કરવું.
- દરરોજ સવારે વહેલા ઉઠીને પક્ષીઓને ચણ/જળ આપવું.
- દરરોજ જમતાં પહેલાં ગાય કે કૂતરાને રોટલો/રોટલી ખવડાવી અને તેની ખાવાની રીતનું અવલોકન કરવું.
- તમને ગમતું કોઈ એક વૃક્ષ વાવવું અને તેનો દરરોજ સાળસંભાળ રાખી ઉછેર કરવો. તેના પાંચથી દસ ઉપયોગો લખવા.
- વેકેશન દરમિયાન ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને તમે કરેલ મદદ વિષે ૮ થી ૧૦ વાક્યો લખાવા.

મારી ભાષાને હું દ્રઢ બનાવવા હું આટલું દરરોજ કરીશ.

- ભગવત ગીતા/સર્વાંગી શિક્ષણના પુસ્તકમાંથી રોજ એક પાઠનું વાચન કરવું.
- દરરોજ એક પાઠનું વાચન કરવું (ગુજરાતી/હિન્દી/અંગ્રેજી) અને દરરોજ એક ફકરો સુંદર અક્ષરે લખવો.
- શાળા પુસ્તકાલયમાંથી આપેલ બે પુસ્તક વાંચવા અને તેનો પુસ્તક પરિચય લખવો.
- દરરોજ પાંચ-પાંચ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ અને સ્પેલિંગ લખવા અને તૈયાર કરવા.
- તમારો અને તમારા મિત્રનો પરિચય હિન્દી અને અંગ્રેજીમાં લખો.
- નિબંધ લખો:- (૧) મેં કરેલો પ્રવાસ (૨) મારો પ્રિય તહેવાર (૩) વૃક્ષો આપણા મિત્રો
- ૧૦૦ સુધી અંકો હિન્દી તેમજ અંગ્રેજીમાં અંકોમાં અને શબ્દોમાં લખવી.

હું મારું ગણન ઢઢ કરવા આટલું જરૂર કરીશ

- ઘર વપરાશની ૫૦ વસ્તુઓના ભાવ જાણી તેનું ભાવપત્રક લખો. તેમાંથી કોઈપણ ૧૦ પ્રશ્નો બનાવી તમારા કુટુંબના સભ્યોને પૂછવા.
- દરરોજ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનો એક-એક દાખલો જાતે બનાવી/મમ્મી-પાપા/બાઈ-બહેન પાસે બનાવી ગણવો.
- ૧ થી ૨૦ સંખ્યાઓના વર્ગ અને ધન લખો અને તૈયાર કરો.
- ૧ થી ૨૫ ના ઘડિયા સીધા, આડા અને ઊંઘા લખવા.

મારામાં રહેલી કલાને વ્યક્ત કરવા માટે હું આટલું કરીશ

- દરરોજ તમને મનપસંદ એક ચિત્રદોરો અને તેમાં તમારા મનગમતા રંગ પૂરો.
- ગુજરાતના જિલ્લાઓનાં નામ ગુજરાતી તેમજ અંગ્રેજીમાં લખો તેમજ ગુજરાતનો નકશો દોરી તેમાં દર્શાવો.
- તમારા વર્ગખંડમાં લગાવવા માટે સુંદર તોરણ બનાવો.
- તમારા ઘરને ઉપયોગમાં આવે તેવી કોઈ બે વસ્તુ બનાવવી (વેસ્ટ માંથી બેસ્ટ બનાવો)
- કોઈ પણ મહાન ૫/૬ વ્યક્તિ વિષે ગુગલ પર સર્ચ કરી તે વ્યક્તિઓ વિશે વધુ જાણકારી મેળવીને લખો. (દા.ત. રમતવીર, વૈજ્ઞાનિક, લેખક, કવિ, કલાકાર...વગેરે)

જ્ઞાન- વિજ્ઞાન ને તાજું રાખવા હું આટલું કરીશ.

- ટૂંકનોંધ લખો:-
(૧) આહારના ઘટકો, (૨) પૃથ્વીનાં આવરણો, (૩) હૃડખીય નગરરચના
- પ્રોજેક્ટ બનાવો :-
(૧) સૂર્યમંડળ (૨) પર્ણપોથી, નકશાના પ્રકાર, (૪) ગુજરાતી લેખકોનો પરિચય.
- આકૃતિઓ દોરો:-
(૧) પુષ્પના ભાગો, (૨) વિવિધ પ્રકારના ચુંબક, (૩) પેરિસ્કોપની રચના (૪) પૃથ્વીના ગોળા પર અક્ષાંશ-રેખાંશ, (૫) હોકાયંત્ર

(અલગ નોટબુકમાં)

- તમે વેકેશન દરમિયાન કરેલી પ્રવૃત્તિને હંમેશા તમારી સાથે રાખવા દરરોજ તમારી રોજનીશી લખવી.